

૫ ક ૨ શ (૪)

અર્લંડાર વિધાન

નાટ્યશાસ્ત્રના ૧૭ માં અધ્યાયમાં ભરતમુનિએ 'લક્ષ્ણો' ઉપરાંત અર્લંડારનો વિવેચન હોય છે. ભરતમુનિ નિરૂપિત લક્ષ્ણો ૩૬ છે જ્યારે અર્લંડારો ૪ છે. લક્ષ્ણોની જે જિન્ન પાઠ પર્દપરાણો છે જ્યારે અર્લંડારનો પાઠભેદની ડેઝ પર્દપરાણનથો. આ ઉપર્યોગમાં ડહો શડાય કે નાટ્યશાસ્ત્રના રચનાઓના સમયે, લક્ષ્ણ પદ્ધતિની સરખામણીમાં અર્લંડાર પદ્ધતિ હજુ બાળ્યાવસ્થામાં હતો. પછીના સમયમાં ભામણ, દૃઢો, વામન, તુદ્દટ અને તુધ્યક વિગેરે આચાર્યાને અર્લંડાર પદ્ધતિનો બેબો નો વિકાસ સાધ્યો કે લક્ષ્ણપદ્ધતિ ડાય્યશાસ્ત્રમણી લુખ થઈ ગઈ.

ડાય્યશાસ્ત્રના અંગરૂપે અર્લંડાર શાસ્ત્રના પ્રથમ પ્રોત્સાહ ભરતમુનિ હનીં એમ અવસ્થા ડહો શડાય.

લક્ષ્ણ અને અર્લંડારની તુલના

લક્ષ્ણ એ ડાય્યનું શરીર છે નો અર્લંડાર નેના પરનું ઘરેલું. શરીરને પોતાનું નૈસર્જિક સૌદ્ય છે અને અર્લંડાર વિના પણ ને શોકે છે. બેટલે અર્લંડારની અપેક્ષા ડર્યા વિના પણ ડાય્ય સૌદ્ય સાધી શકે છે. લક્ષ્ણ નો ડાય્ય શરીરનું, સામુદ્રિક લક્ષ્ણની જેમ અંગસુન નથ્ય છે. જ્યારે અર્લંડાર, રમ્ભણોના ઉજ્જવળ રત્નારણની સમાન બાહ્ય શાખાદાયક અંગ હોલાથી ભરતમુનિનો દૃષ્ટિયે અર્લંડારની અપેક્ષા લક્ષ્ણ વ્યાપક ડાય્યાંગ છે.

અધિનવગુખના ડથન અનુસાર લક્ષ્ણ એ નો ડાય્યરૂપો પ્રાસાદની સિલ્લિ સમાન છે જેના ઉપર ચિત્રસ્થનાને જેમ અર્લંડાર શોકે છે. ડાય્યમાં અર્લંડાર, રત્નમણા સમાન છે કે શરીર ડરણા સિલ્લા છે જ્યારે લક્ષ્ણ શાયદિક સહજ સૌદ્ય છે જે અર્લંડારો વિના પણ સુંદર હોય છે.

અર્લંડાર નિરૂપણ

(શલોક ૪૩. થો ૮૬)

ભરતમુનિના ડથન અનુસાર નાટક વિગેરેમાં સંપ્રાપ્ત નથ્યા પ્રયોગ ડરવામાં

આવતા અલ્લાર ચાર છે. (૧) ઉપમા (૨) રૂપક (૩) દોપડ નથા (૪) વર્પક
(અધ્યાય ૧૭ શ્લોક ૪૩).

ઉપમા, રૂપક રૂપક અને દોપડ અહીંલંડાર છે જ્યારે યમક શબ્દાલંડાર. જો કે આવા
ભેદ ભરનુંનિષે પાડ્યા નથો, ભાગું પાડ્યા છે, જે ભરનુંનિના ઉત્તરણાલોન આચાર્ય છે.
એનો અર્થ એ કે ભરનુંનિના સમયમાં શબ્દાલંડાર અને અર્થાલંડારનો બે વિભાગ પરંપરાઓ
વિડાસ પાંચો નહોંનો.

(૧) ઉપમા

ભરનુંનિના ડયન અનુસાર ॥ જ્યારે બે પદાર્થની ગુણ અથવા પ્રકૃતિ પર
આજિત થઈ સાદૃશ્ય ધ્વારા તુલના ડરવામાં આવે તો નેને ઉપમા ડહેવામાં આવે છે. આ
તુલના એડ પદાર્થના બેઠથી કે અનેકથી, અથવા અનેડ પદાર્થની બેઠથી કે અનેકથી ડરવામાં
આવે છે. નેના કુમશ : ઉદાહરણ આ પ્રમાણે છે. 'તારું મુળ ચન્દ્ર સમાન છે' અહો બેઠની
ઉપમા બેઠથી આપવામાં આવો છે. 'નસ્ત્ર ચન્દ્રમાની કેમ પ્રકાશિન છે' અહો અનેકની
ઉપમા બેઠથી છે. બાજ, પયૂર નથા ગિધ સમાન નેત્ર' - અહો એડ નેત્રની અનેડો સાથે
ઉપમા છે. 'હાથોખો વાદળાનો કેમ છે' અહો અનેકનો અનેડો સાથે ઉપમા છે.

(શ્લોક ૪૪ થી ૪૮)

ઉપમાના પ્રમેદો

વિષયની દૃષ્ટિને ઉપમાના પર્યા પ્રમેદો, લક્ષણ અને ઉદાહરણ સહિન ભરનુંનિષે
આ પ્રમાણો નિરૂપ્યા છે. (શ્લોક ૪૮ થી ૫૫)

ક્રમ	પ્રમેદ	લક્ષણ	ઉદાહરણ
------	--------	-------	--------

	પ્રશ્ના	ઉપમા ધ્વારા પ્રશ્ના	મુનિજન ધ્વારા ડષ્ટથી અજિત સિદ્ધિ સમાન બે વિશાળાક્ષો રમણોને જોઈ રાજી પ્રસંગ થયો.
--	---------	---------------------	---

૨

નિદા ઉપમા ધ્વારા નિદા

જે રમણોએ સર્વ ભૂકોષ્ઠો હોન જેઠંગો
શડલવાળા યે પુરુષને દાવાનિયો દષ્ટ
ડાંટાવાળા વૃક્ષને લતા આદિગે તેમ
આદિગન ડર્યુ.

૩

કાલ્પિકા કલ્યાણજીય ઉપમા/
કલ્યાણમંડિન ઉપમા

મદજલનું વર્ષાંશ કરનારા, લોલાથો મદ
મદ ગતિશાળો આ ગજરાંબ, જંગમ પર્વતોનો
સમાન દેખાય છે.

૪

સદ્ગુરી સાદૃશ્યજીય ઉપમા

બોજાના મનના અનુરોધથી આપે જે ડાર્ય
ડર્યુ ને અતિમાનુષડર્મા પુરુષ આપની
જૈવાજ છે.

૫

ડિંચિન આરીંડ સાદૃશ્યજીય
-સદ્ગુરી ઉપમા

આ મારો સણો ભાવો ગઈ,
પૂર્ણાંનું સમાન મુખવાળો,
નોલક્ષ્મલ સમાન નેતૃત્વોણો,
નથા મદમત્ત સમાન ચાલવાળો.

ઉપમા પ્રભેદના નિરૂપણના અને ભરતમુનિ જ્ઞાવે છે કે ઉપમા અત્યારના સ્વીકૃપમાં
શાટલા બેદ હોય છે. અહીં નેના જે અન્ય પ્રડારોનો લક્ષ્ણો ધ્વારા ઉત્સોખ કરવામાં નથો
આવ્યો નેને લોક પ્રયત્નિન ડાવ્યો ધ્વારા (લોકડાવ્યનઃ) સમજવા જોઈએ. (શલોક ૫૫)

જો કે ઉપમાનું રૂપ પ્રાણોન વૈદિક પંદ્રોમાં પ્રાપ્ત થાય છે નથા યાસ્કના
નિરૂક્તલમાં પણ નેનો ચર્ચા છે પણ ઉપમાની પરિભાષા આપો પ્રભેદ-વિનિષ્ટય કરનાર
ભરતમુનિજી પહેલા આચાર્ય છે. જેના આધારે પણોના સમયમાં અનેક ઉપમામૂલક નવોન
અત્યારો ઉદ્ભવ્યા. અન્વય, ઉપમેયોપમા, પ્રનિવસ્યુપમા, અપહનુનિ, સંદેહ, ક્રાતિમાન,
અનિશ્ચોડિન જેવા સાદૃશ્યમૂલક અત્યારો ઉપમાનો વિસ્તાર અથવા વિકાસજ છે.

(૨) દીપઢ

દીપઢ અત્યારની પરિભાષા આપના ભરતમુનિ જ્ઞાવે છે કે “ ભજ વિષયોભાળા

શબ્દોનો એક વાડયમાં દોપડનો સમાન સર્વોગ થવાથી દોપડ અર્ટડાર જને છે કેચ ડે ત્યાં હંસી વડે સરોળર, પુષ્પો વડે વૃક્ષ, મત્ત ધ્રુમરો વડે ડમળ નથી ગ્રહિઓ વડે ઉપવન સદાય શામાયુહલ રહે છે. ॥ (શલોક ૫૬-૫૭)

એક અર્થ ધ્વારા અનેક અર્થાં દોપડનો કેમ પ્રાણન 'દોપડ' અર્ટડાર ડહેવાય. ભરતમુનિને ઉપમાનો કેમ દોપડના અનેક પ્રભેદ પાડ્યા નથી. અભિનવગુપ્તે ભરતમુનિના લક્ષણના આધારે દોપડ અર્ટડારની પરિસ્થાખા આ પ્રમાણે આધો છે. ॥ એક અવાજન સ્થો અસર્યુહલ રહો જે ડિયા, ગુણ, જાતિ વિગેરની આહારિકાઓની સમયડ પૂર્ણ કરે ને દોપડનો પ્રફુતિને ઠાકો દોપડ સમજજું જોઈએ. ॥ ભરતમુનિ નિરૂપિત દોપડનું ઉદાહરણ નેની પુષ્ટિ કરે છે.

(3) તૃણક

તૃણક અર્ટડારનો પરિસ્થાખા આપણા ભરતમુનિ જ્ઞાવે છે ડે. ॥ પોતાના વિડલ્યથી નિર્મિત 'તુલ્ય અવયવનોના નથી થોડા સાદૃશ્ય ગુણ યુહત અભિન સ્વરૂપ ને તૃણક ડહેવાય છે. ॥' પ્રક્રિયા શલોક અનુસાર અનેક દૃવ્યોના સર્વાધ્યાં ઉપમાના ગુણોનો આશરય લઈ છેના સ્વરૂપનું સમ્યકું કર્શન થયું હોય નેને તૃણક ડહે છે. તૃણક અર્ટડારનું ઉદાહરણ ભરતમુનિ આ પ્રમાણે નિરૂપે છે. ॥ વાપિલોમાં સ્થિત ડાળવણની, કુમુદહાસિની નથી વિડસિન નીલંડમણ સદૃશ નેત્રોનોના લલનાથો દુજિન હંસી ધ્વારા એક બોજાને બતાવતી શારોભિત થઈ. ॥

(શલોક ૫૮-૫૯)

આ અર્ટડારમાં ડિંચિન શાદૃશ્ય નથી તુલ્યાવયવત્વની સ્થિતિ રહે છે. તૃણક અર્ટડારના પ્રણ ભરતમુનિને પ્રભેદ નિરૂપ્યા નથી પ્રણ નેના વિવસ્થાઓ તૃણકનો સાંગ ડે એકદેશવિવર્તિ હોયા વિશેનો સર્વેતન અવશ્ય ભલે છે. તૃણકનું ભરતમુનિ નિરૂપિત લક્ષણ, પણોના ડાળમાં વિડસિન તૃણકના ! સમસ્લ દેશ વિવતી! અને 'એક દેશ વિવતી' નામના ને બેદોનો આધાર જની રહે છે.

(૪) યમડ

'યમડ!' અતંડારનો પરિલાઘા આપનાં ભરતમુનિ જીવાવે છે કે 'શબ્દ'ની આવૃત્તિ યમડ ડહેવાય છે, જે પાદથો પ્રારંભ થઇ અનેક વિધાઓ ધારણ કરે છે. ॥ (શલોક ૫૦)

ભરતમુનિ દ્વારા-ડાવ્ય (નાટક)માં થનારા (નાટકાશ્વયમુ) યમડ અતંડારના ૧૦ પ્રમેદને લક્ષણો અને ઉદાહરણ સહિત આ પ્રમાણે નિરૂપું છે. (શલોક ૬૧ થી ૮૫)

યમડના પ્રમેદો

(૧)

પાદાન્તયમડ	જો ચાર પાદખા અંતમાં સમાન પદ હોય નો નેને પાદાન્તયમડ ડહે છે.	દિનશ્વયાનું સંહુલરાશિમભરડલં દિવોવ લગ્નં નપનીયમરડલં । વિશ્વાનિ લાદું દિવિ સુર્યમરડલં યથા નહુંયાઃ સનનથાર મરડલં ॥
------------	--	---

(૨)

ડાયોયમડ	જો પાદના આદિ નથા અંતમાં સમાન પદ હોય નો નેને ડાયોયમડ ડહે છે.	યામ્યં યામ્યં અન્ધવતીનાં દૃવતીનાં વ્યડતાવ્યડતા સા રજનોનાં રજનીનાં । કુલ્યે કુલ્યે સભુમરે વા ભુમરે વા રામા રામા વિસયને ય સ્વયંતે ય ॥
---------	--	--

(૩)

સમુદ્ગયમડ	લક્ષણવૃત્તના અર્દ્ધભાગની આવૃત્તિ ધ્વારા સર્ફુર્સ વૃત્તની પૂર્ણિને સમુદ્ગયમડ ડહે છે.	ઢેનડોઝુમપાશ્ચ રદન્તઃ શોભતે પ્રવર્ડાનનહસ્તો । ઢેનડોઝુમપાશ્ચ રદન્તઃ શોભતે પ્રવર્ડાનનહસ્તો ॥
-----------	--	--

(૪)

વિડાન્યમડ	જો બેઠ પાદ છોડોને બોજો પાદ સમાન હોય અર્થાત છિનીય અને ચતુર્થ પાદની રમના સમાન હોય નેને વિડાન્ય યમડ ડહે છે.	સ પૂર્વ વાસણો ભૂત્વા છિ શેંગ દીવ પર્વતઃ । અભવેદન્યવૈડલ્યા છિશેંગ દીવ પર્વતઃ ॥
-----------	--	--

(4)

ચડવાતયમડ
જો પાદના શણની બોજા
પાદના પ્રારંભમાં આવૃત્તિ
આવે તો તેને ચડવાતયમડ
કહે છે.

શૈલાસથા શનુભિરાહનાઙુતા
હતાસ્ય બુધુસ્ત્વનું પુંગોઃ ખગોઃ ।
ખગૈસ્ય સર્વેદુધિસંચિતાસ્થિતા
સ્થિતાધિરૂઢા નિહનાસલૈસ્લતઃ ॥

(5)

સંદષ્ટયમડ
જો પાદના પ્રારંભમાં બે
સમાન શણનો આવૃત્તિ
હોય તો સંદષ્ટ યમડ
થાય છે.

ધરય ધૂષય રમણસ્ય મે ગુણાન
યેન ધેન વશમાં કરોતિ પામ્ ।
યેન ધેન હિ ભમેતિ દર્શન
તેન તેન વશગાં કરોતિ પામ્ ॥

(6)

પાદાદિયમડ
જો પ્રત્યેડ પાદના પ્રારંભમાં
આવના રા શણની, આગળના
તમામ પાદએંબાં આવૃત્તિ
થાય તો પાદાદિયમડ
બને છે.

વિષ્ણુ : સૂજલિ ભૂતાની
વિષ્ણુ : સંહરે પ્રજાઃ ।
વિષ્ણુ : પ્રસૂતે ત્રૈલોહર્ય
વિષ્ણુ લોહાધિરૂપનમ् ॥

(7)

આધ્રેડિતયમડ
જો પાદનું અંતિમ પદ બે
વાર બાવુલ થાય તો
તેને આધ્રેડિત યમડ કહે
છે.

વિશ્વીભત નિઃધ્વાસિત મુહુર્મુહઃ
ધર્ય વિધીય સ્ત્રોર્દ્વ પદે પદે ।
યથા ચ તે ધ્યાનધિર્દં પુનઃ પુનઃ
ધ્રુવં ગતા તે રજની વિના વિના ॥

(8)

ચતુર્વ્યવસિત
યમડ
જો ચારે પાદ સમાન
અશ્વરવાળા હોય તો તેને
ચતુર્વ્યવસિત યમડ કહે છે.

વાસ્ત્રાનામયમેવ ડાલો
વાસ્ત્રાનામયમેવ ડાલઃ ।
વાસ્ત્રાનામયમેવ ડાલો
વાસ્ત્રાનામયમેવ ડાલઃ ॥

(9)

માલાયમડ
જ્યારે અનેડ વ્યંજનએથી
ધૂકન બેડજ સ્વર,
વિભિન્ન શણએંબાં આવતો
હોય તો તેને માલા
યમડ કહે છે.

હલો બલો હલો માલો
ખેલો માલો સલો જલો ।
ખલો બલો બલો માલો
મુસલો વખ્ચિરથતુ ॥

ભામહ, યમડના ભરલમુનિ નિરુપિત પ્રમેદનો પરસ્પર અનબાવિ કરે ડેવળ પાય થમડ સ્વોકાર્યા છે. ભરલમુનિ પ્રલિપાદિન થમડ પ્રમેદણે દણી, અગ્નિપુરાશ, ભોમહ, ભાટ્ટ વિગેરે આચામાર્યા ધ્વારા ડાલિત મેદો માટે આધાર પ્રસ્તુત ડર્યા એમ ડળી શડાય. નાદ-સૌદર્ય એ થમડના મુખ્ય પ્રવૃત્તિ છે જે લોકયાત્રના ભાષાને અર્લંફુન કરે છે.

અલંડારોનો રસાશ્રિત પ્રયોગ

અલંડારોના નિરુપણના અને ભરલમુનિ સ્પષ્ટપત્રો જ્ઞાવે છે કે નાટ્યડાલ્યાનો રચના 'અર્થડિયાપેક્ષા' અર્થાત ડિયાસાપેક્ષ અલંડારો વડે થેવો જોઈએ. શાલ્યડાલ્ય અને દૃશ્યડાલ્યમાં પ્રયોજ્ઞાના અલંડારોમાં આ નફાવન રહેલો છે. શાલ્યડાલ્યમાં ડિયાનિરપેક્ષ અલંડારો પ્રયોજ્ઞાઈ થડે પરસ્પર દૃશ્યશાલ્યમાં ડિયાસાપેક્ષ અલંડારોનો પ્રયોગ અનિવાર્ય છે કેમ કે નેજ તેને અભિનેયતા અપાં શકે.

'અર્થડિયા'થી ભરલમુનિનો આશય એ છે કે નાટ્યડાલ્યમાં ભાવ અને રસનો પ્રદિયા અપેક્ષિત છે. અલંડારોઝું નાટ્યભાવમાં રૂપાનિ રથવું આવશ્યક છે.

ભરલમુનિને અલંડારોનો રસાશ્રિત પ્રયોગ અભિપ્રેત છે. તેમના ડથન અનુસાર વીર, રૌદ્ર તથા અદ્ભુત રસોના વર્ણનમાં ઉપમાં અથવા રૂપક અલંડાર, શુંગાર રસમાં રૂપક તથા દીપક અલંડારો પ્રયોજવા જોઈએ. (શલોક ૧૦૭ પૂર્વાર્ધ, ૧૦૮ પૂર્વાર્દી)

અને....

ભરલમુનિ પણના ડાળમાં શાઢાલંડાર અને અર્ધાલંડારનો બે ક્ષિણ પરંપરાઓ વિડાસ પામો. નાટ્યશાસ્ત્રમાં આ પરંપરા સ્પષ્ટ નથી. ભરલમુનિ ધ્વારા થમડના લક્ષણ નિરુપણના સંદર્ભમાં પ્રયોજાયેલો 'શાઢાલ્યાસ' શાઢ, આ બે પરંપરાઓના બોજ સ્વરૂપનો સ્પષ્ટ સંકેત કરે છે. શાઢ અને અર્ધના આધારે અલંડારોનો વિભાજન પરંપરાનો આર્થિક ભામહ પણ દણીબે ડર્યા.

ભરલમુનિને, આ ચાર અલંડારોને નાટ્યલક્ષણો તથા નાટ્ય અલંડારોનો ક્ષિણ માનો

માની નિર્ધયા છે. અન્ય નાટ્યશાસ્ત્રીય ગ્રંથોના નાટકલક્ષ્મિ રણકુષ્ઠ, દશકુષ્ઠ, નાટ્યદર્શિ,
રસાસવ સુધ્યાડર અને ભાવપ્રકાશન વિગેરે ગ્રંથોમાં ડાયશોભાવિધાયડ બેવા આ અર્લંડારોનો
ઉદ્દોષ સુધ્યાંજી નથો. સાગરનાંદોથે તો સ્પષ્ટ પણ પ્રનિપાદિન કર્યું છે કે ડાયશોભાવિધાયડ
અર્લંડાર તથા નાટ્યઅર્લંડાર મેડલીજાથી પૃથ્વી પૃથ્વી હૈ. ઉધ્યમા આદિ અર્લંડાર ડાયશોભા અને
નાટ્યઅર્લંડાર નાટ્યશોભાના અનુભૂંધી હૈ.

અર્લંડારશાસ્ત્રના ઉદ્ભવ અને વિડાસમાં ભરતમુનિ નિરૂપિલ આ ચાર અર્લંડારો નથા
લક્ષ્મિએ મહત્વની ભૂમિડા નિષ્ઠા હૈ. ભરતમુનિએ મુળુપ્યથી ચાર અર્લંડારોના વિવેચન ધ્વારા જે
ડાયમાર્ગનો પાયો નાણ્યો તેનો પૂર્ણ વિડાસ ભામણ, દરડો, ઉદ્ભટ, વામન, તુદટ, કુષ્ઠ,
મઘટ, વિશ્વનાથ જેવા આચાર્યની હર્યાં આમ ભરતમુનિના અર્લંડારવિધાનનું ઐલિલાસિડ મૂલ્ય હૈ.